

ગ્રંથમાલિકા ‘આચારધર્મ’ : નિદ્રા - ખંડ ૧

શાંત નિદ્રા માટે શું કરવું ?

(How To sleep peacefully ? - Gujarati)

ગ્રંથનું મનોગત

અત્યારનું ધાંધલઘમાલનું જીવન, કૌટુંબિક કે કાર્યાલયીન તણાવ આહિને કારણે મોટા ભાગના લોકોને શાંત નિદ્રા આવવી અધરું થઈ બેનું છે. જો શાંત નિદ્રા ન આવે, તો આગળના દિનક્કમ પર માણું પરિણામ થાય છે. ઊંઘને લગતી સમસ્યા છોડાવવા માટે ધણાં લોકો આધુનિક વૈદ્ય પાસે (ડોક્ટર પાસે) જાય છે. ડોક્ટર ઔષધ આપે છે અથવા વ્યાયામ પ્રકાર સૂચ્યવે છે. ‘એલોપેથી’ એના કરતાં કાંઈ વિશેષ વિચાર કરતી નથી. નિદ્રા વિશેના નિસર્ગ નિયમ અને નિદ્રા વિશેનો આચાર ન પાળવો, આ શાંત નિદ્રા ન આવવાની સમસ્યાનું મૂળ છે. પ્રસ્તુત ગ્રંથમાં નિદ્રા વિશેનો ત્રાસ ટળીને શાંત નિદ્રા આવવા માટે માથું કરી દિશા તરફ કરવું, પૂર્ણ અંધારું કરીને શા માટે ન સૂવું છે. બાબતો પાછળનું અધ્યાત્મશાસ્ત્ર વિશેદ કર્યું છે.

ક્યારેક ઊંઘ ન આવવાના કોઈ પણ બાહ્ય કારણો વર્તીતા નથી. ક્યારેક ઊંઘમાં બડબડાટ કરવો, પથારીમાથી ભાગી જવાનો પ્રયત્ન કરવો આવા બનાવ બને છે. આની પાછળ અનિષ્ટ શક્તિનો ત્રાસ, આ કારણ હોય છે. રાત્રિના સમયે અનિષ્ટ શક્તિઓનું બળ વધુ હોવાથી વ્યક્તિ નિદ્રાધીન હોય ત્યારે જ તેના પર અનિષ્ટ શક્તિ સહેતાઈથી આકમણ કરી શકે છે. તેથી સવારે વહેલા ઊંઘ ન ઉડવી, જો ઊંઘ ઉડે તો તરત જ ઊભું ન થઈ શકવું, શરીર ભારે થવું, ઉત્સાહ ન હોવો એવા ત્રાસ થાય છે. આના પર આધ્યાત્મિક ઉપાય જ યોજવા પડે છે.

સૂઈ ગયા પછી વ્યક્તિની સૂવાની દિશામાં અને સ્થિતિમાં પરિવર્તન થાય છે. ધાણીવાર તેની પાછળ અનિષ્ટ શક્તિનો ત્રાસ એ જ કારણ હોય છે. આ સમયે કુટુંબના અન્ય સહસ્યો તે વ્યક્તિને પઢભે ફેરવીને તેનું માથું પૂર્વ તરફ કરવાની યોગ્ય કૃતિ કરી શકે. ઊંઘમાં અનિષ્ટ શક્તિઓનો ત્રાસ ન થાય, તે માટે પથારી ફરતે દેવતાની નામજપ-પદ્મીઓનું વર્તુળ કરવું, ઓશીકા પાસે સાત્ત્વિક ઉદ્ભિતી લગાડવી આવા આધ્યાત્મિક ઉપાયો વિશે પણ ગ્રંથમાં માર્ગદર્શન કર્યું છે.

ગ્રંથમાં કહ્યા પ્રમાણે આચરણ કરીને મનુષ્યને સ્વાસ્થ્ય પ્રદાન કરનારી શાંત નિદ્રા મળે અને તેની હિંદુ ધર્મમાં આપેલા આચારો પ્રત્યેની શ્રદ્ધા વધે, એ જ શ્રી ગુરુચરણોમાં પ્રાર્થના ! - સંકલક

અનુક્રમણિકા

(કેટલાક વિશિષ્ટતાપૂર્વી સૂત્રો [મુદ્રાઓ] '*' ચિહ્નથી દર્શાવ્યાં છે.)

૧. કળિયુગના માનવી જીવનની વિશિષ્ટતાઓ	૧૬
૨. નિદ્રાની ઉત્પત્તિ અને અર્થ	૧૬
૩. નિદ્રાનું મહત્વ	૧૬
૪. નિદ્રાયુક્ત કર્મની વિભિન્નતાઓ અને આ કર્મોનું માનવી જીવન પર થનારું દુઃપરિણામ	૨૦
૫. નિદ્રાનો કાલાવધિ	૨૦
* વય અનુસાર * ત્રિગુણો અનુસાર * પ્રકૃતિ અનુસાર	૨૦
૬. નિદ્રા આવવાના કારણો અને પ્રક્રિયા	૨૧
૭. સૂવા માટેનું સ્થાન કેવું હોવું જોઈએ ?	૨૨
૮. પથારીના પ્રકાર અને તેનાથી થનારા લાભ અને નુકસાન	૨૨
* ગાદલા પર સૂવાના અને કેવળ ભૂમિ પર સૂવાના લાભ અને નુકશાન	૨૩
* ભૂમિ, પલંગ, વાંસની સાઢી અને દર્ભાસન પર સૂવું	૨૪
* આદર્શ પથારી / શાચ્યા કેવી હોવી જોઈએ ?	૩૦
૯. નિદ્રા પહેલાં કરવાની સિદ્ધતા (તૈયારી)	૩૦
* જો પગ ભીના હોય, તો કોરા કરીને શા માટે સૂવું ?	૩૦
* સૂતી વખતે માથા પાસે પાણી ભરેલો લોટો શા માટે મૂકવો ?	૩૧
* સૂતી વખતે પથારી પાસે લાકડી મૂકવા પાછળનું શાસ્ત્ર	૩૧
૧૦. રાત્રે સૂતા પહેલાં બોલવાના મંત્રો, કરવાની પ્રાર્થના અને નામજ્ય	૩૨
* સૂવા પહેલાં કયા શલોક / મંત્ર બોલવા ?	૩૨
* નિદ્રાદેવીને અથવા ઉપાસ્ય દેવતાને કઈ પ્રાર્થના કરવી ?	૩૩
* ઉપાસ્ય દેવતાનો નામજ્ય કરતાં કરતાં સૂઈ જવું	૩૪
૧૧. નિદ્રાના સંબંધમાં કેટલાક આચાર અને તે પાછળનું શાસ્ત્ર	૩૪
૧૧ અ. ક્યાં સૂવું નહીં ? (પૂજાધર, નિર્જન ધર, દેવાલય ઈત્યાદિ સ્થાને, તેમ જ અંગારા પાસે, છતના મોબ નીચે અને ઝાડ નીચે સૂવાનું ટાળવું.)	૩૪
૧૧ આ. આયુર્વેદ અનુસાર ક્યારે સૂવું, ક્યારે ન સૂવું અને અન્ય સૂત્રો	૩૮

૧૧ ઈ. કયારે સૂવું અને કયારે ન સૂવું ?	૪૨
૧૧ ઈ. એંણાં હાથ લઈને બેસવું અથવા સૂવું નહીં, એ પાછળનું શાસ્ત્ર	૪૬
૧૧ ઉ. નવાં કપડા પહેરીને ન સૂવા પાછળનું શાસ્ત્ર	૪૬
૧૧ ઉ. નન્ન થઈને સૂવું નહીં	૪૬
૧૧ એ. અનિષ્ટ શક્તિઓનો ત્રાસ ઘરાવતી વ્યક્તિઓએ ઉધાડા શરરિ ઊંઘવું અથવા ફરવું નહીં, એનું કારણ શું ?	૪૭
૧૧ એ. વડીલોની પથારી પર શા માટે સૂવું નહીં.	૪૮
૧૧ ઓ. સામાન્ય (આધ્યાત્મિક ત્રાસ ન હોય તેવા) વ્યક્તિએ અન્ય સામાન્ય વ્યક્તિની પથારી પર સૂવાથી થનારા સૂક્ષ્મ-પરિણામ	૫૦
૧૧ ઔ. પથારી પર પાથરેલું વસ્ત્ર શરીર પર લઈને શા માટે સૂવું નહીં ?	૫૨
૧૧ અ. રાત્રિના સમયે ઘરમાં અંધારું કરીને શા માટે સૂવું નહીં ?	૫૩
૧૧ ક. સૂતેલા માણસને ઓળંગીને શા માટે જવું નહીં ?	૫૩
૧૧ ખ. સૂતેલી વ્યક્તિને ડરાવીને શા માટે ઉઠાડવી નહીં ?	૫૩
૧૧ ગ. સૂતેલા માણસને નમસ્કાર શા માટે કરવા નહીં ?	૫૪
૧૧ ધ. ખાખર, ઉંબર, પીપળો, જંબુ ઇત્યાદિ વૃક્ષોના લાકડાંમાંથી બનાવેલા પલંગ પર સૂવા પાછળનું શાસ્ત્ર શું છે ?	૫૬
૧૧ ચ. સૂવા માટે જુદા-જુદા પ્રકારના લાકડાંનો, તેમ જ તૂટેલાં અથવા તો તડ પડેલા લાકડાનો ઉપયોગ શા માટે કરવો નહીં ?	૫૬
૧૧ છ. મરી ગયેલા હાથીના દાંતમાંથી (પ્રેતગજદંત) બનાવેલા પલંગ પર શા માટે સૂવું નહીં ?	૫૭
૧૨. સૂવાની યોગ્ય અને અયોગ્ય પદ્ધતિ અને તે પાછળનું શાસ્ત્ર	૫૭
* ડાબા પડખે સૂવાથી થનારા લાબ	૫૭
* અમસ્તુ પણ પડખે સૂવું અને માંત્રિકોનું આકમણ થઈ રહ્યું હોય ત્યારે પડખે સૂવું એમાં ભેટ	૫૮
* વ્યક્તિની સૂવાની વિવિધ પદ્ધતિઓને કારણો તેના પર થનારા સૂક્ષ્મમાંના પરિણામોની (વિશિષ્ટતાઓની) તુલના	૬૫
* દક્ષિણોત્તર અથવા દક્ષિણ તરફ પગ કરીને ન સૂવાનાં કારણો	૭૨
* ઘૂંટી એકબીજા ઉપર મૂકીને શા માટે બેસવું અથવા સૂવું નહીં ?	૭૬
૧૩. નિદ્રા અને અનિષ્ટ શક્તિ	૭૭
* નૈસર્જિક નિદ્રા અને અનિષ્ટ શક્તિઓના ત્રાસને લીધે આવનારી નિદ્રા	૭૭
* વ્યક્તિ નિદ્રામાં હોય ત્યારે માંત્રિકો તેના પર આકમણ ન કરે, એ માટે શું કરવું જોઈએ ?	૭૮

* સૂતા પછી અનિષ્ટ શક્તિઓ સામે રક્ષણ થવા માટે સૂતી વખતે કરવાના આધ્યાત્મિક ઉપાય	૭૬
૧૪. નિદ્રા અને સમાધિ	૮૫
૧૫. પરાત્પર ગુરુ ડૉ. જ્યંત આઠવલેજી (સંકલક)ની નિદ્રા	૮૬
૧૬. એક સાધિકા પર તેના પોતાના ઓરડામાં અને પ.પૂ. ડોક્ટરજી પહેલાં સેવા કરતા હતા, તે ઓરડામાં પ્રયોગ તરીકી સૂઈ ગયા પછી થનારાં પરિણામોનું (પૂ.) સૌ. યોયા વાલેએ કરેલું સ્ક્રેન-પરિક્ષણ, તેમ જ તે સાધિકાને જણાયેલાં સૂત્રો	૯૧
૧૭. 'ઇલેક્ટ્રોસોમેટોગ્રાફિક' સ્કેનિંગ ઉપકરણ દ્વારા 'નિદ્રા' સંદર્ભમાં વૈજ્ઞાનિક દર્શિએ કરેલો પ્રયોગ	૯૪
૧૮. કળિયુગમાં સત્ત્વગુણી નિદ્રા માટે, એટલે કે શાંત નિદ્રા માટે સાધના કરવી. આવશ્યક અને તે વિશેના વિશિષ્ટતાપૂર્વી સૂત્રો	૧૦૧